

# આ સમયે આટલું કરશો નહીં:

હરિયાળી પરિસર, બગીચા, ફૂલો,  
વૃક્ષો અને થડ વિનાના ઝાડવાંને શહેરના  
પાણીનો ઉપયોગ કરીને પાણી પિવડાવવું



**આ સમયે આટલું કરશો નહીં:**  
બહાર આવેલા પૂલ અથવા હોટ ટબને ભરવું




**આ સમયે આટલું કરશો નહીં:**  
તમારી મોટરને વાહન ચલાવવાના માર્ગ  
પર અથવા શેરીમાં ધોવી



**આ સમયે આટલું કરશો નહીં:**

અહીં જે આપેલી છે તેના સહિતની  
બહારની સપાટીઓને ધોવી:



- બારીઓ
- ઇમારતની બહારની સપાટીઓ
- ફૂટપાથ, વાહન ચલાવવાના માર્ગો અથવા પગદંડીઓ

**આ સમયે આટલું કરશો નહીં:**

તમારા બહારની બાજુએ રહેલા પ્રોપેન અથવા અગ્નિકુંડ માટેના લાકડાંનો ઉપયોગ કરો




કેલગરી, આવા સમય દરમિયાન  
શાંતિ અને સહકાર જાળવી રાખવા  
માટે તમારો આભાર




# તમે આટલું કરીને ઘરની અંદર પાણીના ઉપયોગને ઘટાડવામાં મદદ કરી શકો છો:

જ્યારે જરૂર હોય ત્યારે જ અને સંપૂર્ણ લોડ સાથે  
જ ડીશવોશર અને વોશિંગ મશીનનો ઉપયોગ કરીને



# તમે આટલું કરીને ઘરની અંદર પાણીના ઉપયોગને ઘટાડવામાં મદદ કરી શકો છો:

સ્નાન કરવાના સમયને બે થી ત્રણ મિનિટ જેટલો મર્યાદિત કરો અને ઉપલક્ષિયું સ્નાન કરો



**2-3 મિનિટ**



**તમે આટલું કરીને ઘરની અંદર પાણીના ઉપયોગને ઘટાડવામાં મદદ કરી શકો છો:**  
શાકભાજી અને ફળોને એક આંશિક રીતે ભરેલી ગોંડી અથવા વાસણમાં રાખી લીધાં બાદ તેને ઝડપથી ધોવા



**તમે આટલું કરીને ઘરની અંદર પાણીના  
ઉપયોગને ઘટાડવામાં મદદ કરી શકો છો:**

**ખોરાકને ઘોઈ નાંખવાને બદલે  
તમારી પ્લેટને સાફ કરો**



# તમે આટલું કરીને ઘરની અંદર પાણીના ઉપયોગને ઘટાડવામાં મદદ કરી શકો છો:

જ્યારે બ્રશથી દાંત સાફ કરતા હોવ અથવા દાઢી કરતા હોવ ત્યારે નળ બંધ કરવા

